

August 16, 2024

To,

BSE Limited National Stock Exchange of India Limited

25, P. J. Towers, Exchange Plaza, C-1, Block G,

Dalal Street, Bandra – Kurla Complex, Bandra (E)

Mumbai – 400 001 Mumbai – 400 051 Scrip Code: 500120 Symbol: DIAMINESQ

Sub. Publication of Postal Ballot Notice & E-voting information in Newspaper Ref: Intimation under Regulation 30, 47 of SEBI (listing Obligations & Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Ma'am,

Please find enclosed herewith copies of Notice published in Business Standard (English newspaper) and Vadodara Samachar (Gujarati newspaper) regarding Postal Ballot & E-voting information.

Kindly take the same on record.

Thanking You,

Yours Faithfully, For Diamines and Chemicals Limited

Hemaxi Pawar Company Secretary Membership No.: A52581

ENCL: As above

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Bhesan branch: At and Post, Bhesan, Via Rander Dist: Surat, Gujarat-395005.Contact No:- 8980026719 E-MAIL:bhesur@bankofbaroda.com

Possession Notice (for Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002]

Whereas, The undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 03.06.2024 calling upon the borrower/mortgagor Mr. Tulsibhai Gordhanbhai Langadia (Borrower) & Mrs. Dipaben Tulsibhai Langadia (Co-Borrower) to repay the amount mentioned in the notice being Rs.21,900,27.23/- (Rupees Twenty One Lakhs Ninety Thousand Twenty Seven and Twenty Three paisa only) plus Further Interest thereon and Other Charges within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the day of **12thday of August of the year 2024**.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda**, for an amount of **Rs.21,900,27.23**/- plus Further Interest thereon and Other Charges.

Description of the Immovable Property All that piece and parcel of the property bearing Plot No. 94 admeasuring 31.00sq.mtrs along with margin land admeasuring 34.61sq.mtrs totally admeasuring 65.61 sq. Mtrs i.e 78.44 sq. yard of said residency which is known as "Radha krushna Row House" along with construction admeasuring 65.61sq.mtrs made thereon along with undivided proportionate admeasuring 10.23 sq. Mtrs share in road and COP of said society situated at R.S.NO.445/1,445/2+446, Block no.432/B admeasuring about 21987.58sq.mtrs of village: Kholwad, Taluka: Kamrej, District: Surat. Boundaries: East: Open Plot No.95, West: Open Plot No.93. North: Society Internal Road. South: Society Boundary

Date : 12.08.2024 Place : Surat Authorized Officer Bank of Baroda, Bhesan Branch, Surat

Asian Petroproducts and Exports Limited Regd. Office: 24, Suwernapuri Soceity, Chikuwadi, Near Jetalpur Road, Alkapuri, Vadodara 390 007 Website: www.asianpetro.org, Email: barodagroup99@gmail.com

CIN: L23209GJ1991PLC01666 Extract of Unaudited Financial Results for the Quarter

	ended on 30 th June, 2024 (F					
Sr.	Particulars	Q	Quarter ended 30.06.202431.03.202430.06.2023			
No	Faiticulars	30.06.2024				
		Unaudited	Audited	Unaudited	Audited	
1.	Total Income from Operations	0.25	0.00	0.00	0.00	
2.	Net Profit/(Loss) for the period before tax	(26.32)	(39.42)	(11.84)	(104.16)	
3.	Net Profit/(Loss) for the period after tax	(26.32)	(39.42)	(11.84)	(104.16)	
4.	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(26.32)	(39.42)	(11.84)	(104.16)	
5.	Paid up Equity Share Capital	866.75	866.75	866.75	866.75	
6.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year	-	-	-	-	
7.	Earning per share 1. Basic (in Rs.) 2. Diluted (in Rs.)	(0.30) (0.30)	(0.45) (0.45)	(0.14) (0.14)	(1.20) (1.20)	

The above Financial Results are reviewed by Audit Committee and thereby have beer taken on records by Board of Directors in their Meeting held on 14th August, 2024.
 The Financial Results for the quarter ended on 30th June, 2024 has been reviewed by

the Statutory Auditors of the Company.

The Company operates only in one segment

बैंक ऑफ इंडिया

Previous period figures have been regrouped and reclassified, where necessary, to make them comparable with current period figures.

Date: 14.08.2024 Place: Vadodara

receipt of the said notice.

| BANK OF INDIA - HALOL BRANCH 1st Floor, Shyam Sharad Complex, Opp. S.T. Depo

By the Order of the Board

Managing Director

Jaykishor Chaturvedi

Bank of India Baroda Road, Halol-389350.Ph: 02676 - 224242, Email:Halol.Vadodara@bankofindia.co.in Appendix-IV (See rule-8(1) POSSESSION NOTICE (for Immovable property)

Whereas, The undersigned being the authorized officer of the PN Patel under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 12.09.2023 calling upon the borrower Mr. Mehmudkhan Azizkhan Pathan to repay the amount mentioned in the notice being Rs.3,60,550.69 + INTT(Three lakhs Sixty Thousand Five Hundred and Fifty rupees and Sixty Nine paise+ Intt) within 60 days from the date of

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement) Rules, 2002 on this the 09th day of August month of the year 2024.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of India Halol for an amount Rs.3,60,550.69 and interest

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Pr

All that part and parcel of the property consisting of City Servey No -1751 Property No 1356/A Porval Faliya near Seva Sadan At- Kalol, Dist-Panchmahal. Land Area 76.08 Sq Mtrs. and Construction Area 75.45 samts Bounded: On the North by: House of Maganbhai Zalabhai, On the South by:Road, On the East by: Road, On the West by: Road. Authorised Officer-Bank of India

Date: 09.08.2024 - Place: Halol

Bhesan Branch, At and post, Bhesan, via Rander, Dist. Surat, Gujarat-395005 Phone No: 0261-2516052, 8980026719, Email: bhesur@bankofbaroda.com कैंक ऑफ़ बड़ौदा Bank of Baroda NDER SUB-SECTION (2) OF SECTION 13 OF THE SARFAESI ACT. 2002) NOTICE TO GUARANTOR o. Mr. Yunus Ismail Ashraff (Guarantor)

5/79. Limda Oli Street, Nr. Chunavad Masiid Street, Bander, Bhesan, Surat-395003

Sub: Notice under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, hereinafter called "The Act" A/c Mrs. Aishabibi Usman Bharoocha & Mr. Esmail Usman Bharoocha (Borrower's) Re: Your guarantee for credit facilities granted to Mrs. Aishabibi Usman Bharoocha & Mr. Esmail Usman Bharoocha (38290600000325).

(1) As you are aware, you have by a guarantee dated 26-07-2018 guaranteed payment on demand of all moneys and discharge all obligations and liabilities then or at any time thereafter owing or incurred to us by Mrs. Aishabibi Usman Bharoocha &Mr. Esmail Usman Bharoocha &Mr. Esmail Usman Bharoocha for aggregate credit limits of Rs. 19.69 lakhs with interest thereon more particularly set out in the said guarantee document. To secure the guarantee obligation you have also provided following securities to us.

Equitable Mortgage of Flat No. 101 admeasuring 88.01 sq.mtrs. of Built Up area (admeasuring 855.00 sq.fts Carpet area and 1425.00 sq.fts of Super Built Up area) Situated at 1st floor of Building No. B of	S. NO.	Brief Description of Property	Security Agreement	Area	Boundaries
"Elight Enclave" constructed on the land admeasuring 6090 sq.mtrs of F.P.No. 94, T.P.Scheme No. 29 (Rander), City Survey Nondh No. 34/B admeasuring 7892 sq.mtrs. and City Survey Nondh No. 35/B of ward Rander, Taluka: City; District. Surat. in the name of Mr. Esmail Usman Bharoocha.		101 admeasuring 88.01 sq.mtrs. of Built Up area (admeasuring 855.00 sq.fts Carpet area and 1425.00 sq.fts of Super Built Up area) Situated at 1st floor of Building No. B of "Elight Enclave" constructed on the land admeasuring 6090 sq.mtrs of F.P.No. 9 4, T.P.Scheme No. 29 (Rander), City Survey Nondh No. 34/B admeasuring 7892 sq.mtrs. and City Survey Nondh No. 35/B of ward Rander, Taluka: City, Sistrict: Surat. in the name of Mr. Es mail Us man		88.01 sq.mtrs. of Built Up area (Admeasuring 855.00 sq.fts Carpet area and 1425.00 sq.fts of Super Built Up	and Flat No. B- 104, South: Margin Space, Esat: Margin Space and COP, West: Flat No.

(2) We have to inform you that the borrower has committed defaults in payment of his liabilities and consequently his account has been classified as non-performing asset as on 30-06-2024. A copy of the notice dated 31-07-2024 Under section 13(2) of the 30-06-2024. A copy of the notice dated 31-07-2024 Under section 13(2) of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 sent by us to the borrower is enclosed. Since the borrower has committed defaults, in terms of the guarantee you have become liable to pay to us the outstanding amount of loan/credit facilities aggregating Rs. 16,86,983.07 + Interest and Other Charges TL account as stated in para 1 above and further uncharged interest from 27/07/2024 and other charges in Tl account, and we hereby invoke the guarentee and call upon you to pay the said amount within 60 days from the date of this notice. Please note that interest will continue to accrue at the rates specified in para 1 of the notice dated 31-07-2024 served on continue to accrue at the rates specified in para 1 of the notice dated **31-07-2024** served or the borrower (copy enclosed). (3) We further wish to inform you that in regard to the security provided by you to secure your guarantee obligations for the due repayment of the loans and advances by the borrower, this notice of 60 days may please be treated as notice under sub-section (2) of section 13 of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. We further give you notice that failing payment of the above amount with interest up to the date of payment, we shall be at liberty to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act, which please note.

(4) We further invite your attention to sub section (8) of section 13 of the said Act in terms of which vou may redeem the secured assets. if the amount of dues together with al costs, charges and expenses incurred by the Bank is tendered by you, at any time before the date of publication of notice for public auction/inviting quotations/tender/private treaty. Please note that after publication of the notice as above, your right to redeem the secured assets will not be available (5) We invite your attention to sub-section(13) of section 13 of the said Act in terms of which you are barred from transferring any of the secured assets referred to in para 1 above by way of sale, lease or otherwise (other than in the ordinary course of business), without obtaining our prior written consent. We may add that non-compliance with the above provision contained in section 13(13) of the said Act, is an offence punishable under section 29 of the Act. (6) Please note that this demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies e may have, including without limitation, in the right to make further demands in respect of sums owing to us.

Authorized Officer, Bank of Baroda Date: 31.07.2024

BARODA EXTRUSION LTD Regd. Office :- Survey No 65-66, Village Garadhiya, Jarod - Samalaya Road Ta. Savli, Dist. Vadodara Pin 391520. Web.: www.barodaextrusion.com

CIN NO.: L27109GJ1991PLC016200 Email. works@barodaextrusion.com ANNEXURE - I Statement of Standalone Unaudited Financial Populte for the year anded 30.06.202

	[See Regulation 47(1) (b) of the SEBI (LODR) Regulations, 2015] (Rs					
Sr. No.	Particulars	Quarter Ending	Date Figures	Corresponding 3 months ended in the previous year		
NO.		30-Jun-24	31-Mar-24	30-Jun-23		
		(Unaudited)	(Audited)	(Unaudited)		
1	Total Income from Operations	3,306.19	12,780.41	3,255.35		
2	"Net Profit / -Loss for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	14.23	-109.8	-5.96		
3	Net Profit/Loss for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	14.23	-109.8	-5.96		
4	Net Profit/Loss for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	14.23	-109.8	-5.96		
5	Total Comprehensive Income for the period [Comprising Profit/Loss for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	14.23	-110.71	-5.96		
6	Equity Share Capital	1,490.49	1,490.49	1,490.49		
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-5,432.86	-5,432.86	-5,432.86		
8	"Earnings Per Share (of Rs. 1/- each) (for continuing and discontinued operations) - 1) Basic:	0.01	-0.07	0.00		
	2) Diluted:	0.01	-0.07	0.00		

Note:

a) The above is an extract of the detailed format of Quarterly/Annual Financia Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (URL of the filings).

b) The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote

c) #-Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable

> For Baroda Extrusion Limited Sd/-

Parasmal Kanugo Date : Aug 14th, 2024 **Managing Director** Place: Vadodara Din No. 0920021

Brijlaxmi Leasing and Finance Limited

Suwernapuri Soceity, Chikuwadi, Near Jetalpur Road, Alkapuri, Va Website: www.brijlaxmi.com, Email: barodagroup99@gmail.com. CIN: L65993GJ1990PLC014183

Extract of Unaudited Financial Results for the First Quarter ended on 30th June, 2024 (Rs. in Lakhs) Quarter ended

ı.	Particulars	Quarter erraea rear erra				
0.	i di ticulai s	30.06.2024	31.06.2023	31.03.2024	31.03.2024	
		Unaudited	Unaudited	Audited	Audited	
١.	Total Income from Operations	49.53	64.95	58.41	317.53	
2.	Net Profit/(Loss) for the period (before tax, Exceptional Items & or Extraordinary Items)	(62.80)	18.28	(15.23)	90.56	
3.	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or Extraordinary Items)	(62.80)	18.28	(15.23)	90.56	
l.	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or Extraordinary Items)	(62.80)	13.53	(2.38)	75.95	
	Total comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	(62.80)	13.53	(2.38)	75.95	
ŝ.	Paid up Equity Share Capital	646.35	564.85	646.35	646.35	
7.	Earning per share	(0.97)	0.24	(0.04)	1.18	
NI.	-ta:					

1. The above standalone financial results for the guarter ended 30.06,2024 have been reviewed by the Audit Committee and there after approved and taken on record by the Board of Directors of the Company at their meeting held on 14th August, 2024. The Financial Results for the quarter ended 30th June, 2024 has been review by the

Statutory Auditors of the Company.

3. The Company being engaged in Investment and financing activities and accordingly there is no separate reportable segment as per IND AS 108 specified under section

133 of the Companies Act, 2013.

Previous period figures have been regrouped and reclassified, where necessary, to

make them comparable with current period figures. Comparable, wherever necessary By the Order of the Board Siddharth Chaturvedi Managing Director and CFO Date: 14.08.2024

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda

Mandir Branch: At & Post Mandir, Tekra Faliya Taluka. Jalalpore, District Navsari - 396472. Moh No: 9687680746. E-mail: Mandir@bankofbaroda.com

APPENDIX IV [See Rule 8(1)] Possession Notice

Whereas, The undersigned being the Authorised Officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 read with the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 23.05.2024 calling upon the Borrower & Mortgager Mr. Rajeshbhai Chimanbhai Naik and Co-borrower & Co-Mortgager Mrs. Pritiben Rajeshbhai Naik to repay the amount mentioned in the notice being Rs.12,97,794.38 (Rupees Twelve Lac Ninety Seven Thousand Seven Hundred Ninety Four and paise Thirty Eight only) within 60 days from the date of receipt of the said

The Borrower/ Mortgager and Co-borrower & Co - Mortgager having failed to repay the amount, notice is hereby given to the Borrower/ Mortgager and Co-borrower & Co - Mortgager and the public in general that the undersigned has taken possession of the Property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said Rules on this 14th day of August of the yea

The Borrower/ Mortgager and Co-borrower & Co - Mortgager in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda** for an amount of **being Rs.12,20,009.1**5 (Rupees Twelve Lac Twenty Thousand Nine Rupees and paise Fifteen only) as on 14.08.2024 (Inclusive Of interest 14.08.2024) and further interest and other charges & expenses thereon until full and final payment. Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in

respect of time available, to redeem the secured assets

- Description of immovable property Description or immovable property

All pieces and parcel of immoveable property in the From of residential house bearing Gram Panchayat House no.343 standing on Garntal land admeasuring 108.73 sq.mtrs. and construction thereon in Patel Faliya of village Mandir, Taluka Jalalpore, Distriet Navsari standing in the name of Mr. Rajeshbhai Chimanbhai Naik and Mrs. Pritiber Rajeshbhai Naik and bounded as follows:

East: Property of Nitinbhai Dhirubhai Naik i.e. G.H. No. 342, West: Property of Falguniben Devangkumari.e. G.H. No. 344, North: Wada Kachha Land, South: Public Road.

Date: 14.08.2024 Place: Navsari. Chief Manager & Authorized Officer

BOOK YOUR COPY

Call **022 24978470** SMS reachbs to 56677 Email us at order@bsmail.in



EMPOWER INDIA LIMITED CIN-: L51900MH1981PLC023931

REGISTERED OFFICE: 25/25A, II Floor, 327, Nawab Building, D. N. Road, Fort, Mumbai – 400 001 Phone: 919702003139; Email: info@empowerindia.in; Website: www.empowerindia.in EXTRACT OF STATEMENT OF STANDALONE & CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED 30.06.2024 [Rs in Lakhs except Earning/(loss) per share

_			Standalone Consoli			Consolidated	olidated		
Sr. No.		Quarter ended 30.06.2024 (Unaudited)	Year ended 31.03.2024 (Audited)	Quarter ended 30.06.2023 (Unaudited)	Quarter ended 30.06.2024 (Unaudited)		Quarter ended 30.06.2023 (Unaudited)		
1	Total Income from Operations	679.001	8,519.384	346.577	3,800.447	12001.491	346.577		
2	Net Profit / (Loss) for the period								
	(before Tax and Exceptional items)	88.744	293.571	41.052	212.400	701.271	40.427		
3	Net Profit / (Loss) for the period before tax								
	(after Exceptional items)	88.744	293.571	41.052	212.400	701.271	40.427		
4	Net Profit / (Loss) for the period after tax								
	(after Exceptional items)	88.744	283.571	41.052	212.400	691.271	40.427		
5	Total Comprehensive Income for the period								
	[comprising profit/(loss) for the period (after tax)								
	and other comprehensive income (after tax)]	88.744	283.571	41.052	212.400	691.271	40.427		
6	Equity Share Capital	11,637.99	11,637.99	11,637.99	11,637.99	11637.99	11637.99		
7	Other equity (excluding Revaluation Reserve) as								
	shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	-		
8	Earnings Per Share (of ₹1/- each)								
	(for continuing and discontinued operations)-								
	Basic & Diluted#	0.008	0.024	0.004	0.0180	0.059	0.0035		
Not	Notes: The above result is an extract of the detailed format of Unaudited Standalone and Consolidated Financial Results for the quarter								

ended 30th June 2024 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly results is available on website of Stock Exchange and on Company's website Figures of the previous year have been re-grouped/ re-arranged / re-classified wherever considered necessary

> For Empower India Limited Sd/alan Srinivasa Iveng **Managing Director**

DIN: 00016496

Place: Mumbai Date: 14/08/2024

ORIENT GREEN POWER COMPANY LIMITED Registered office: Bascon Futura SV, 4th Floor, No: 10/1, Venkatanarayana Road, T. Nagar, Chennai -600017

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2024

		Ougston Fuded	Voor Ended	(Rs. in Lakhs)
	.	Quarter Ended	Year Ended	Quarter Ended
S.No.	Particulars	30/06/2024	31/03/2024	30/06/2023
		Unaudited	Audited	Unaudited
1	Total Income from Operations	6,839	26,922	6,782
2	Net Profit/(Loss) for the period			
	(before tax, Exceptional items and/or Extraordinary items)	612	2,237	568
3	Net Profit/(Loss) for the period before tax			
	(after Exceptional items and/or Extraordinary items)	612	3,867	929
4	Net Profit/(Loss) for the period after tax, Exceptional and/or		0.040	200
_	Extraordinary Items (before discontinued operations)	600	3,840	929
5	Net Profit/(Loss) for the period after tax from discontinued operations	705	-	-
6	Net Profit/(Loss) for the period after tax from continuing and	4 005	0.040	
_	discontinued operations (after Exceptional and/or Extraordinary items)	1,305	3,840	929
7	Total Comprehensive Income for the period [Comprising Profit/(Loss) for	4 000	0.000	007
	the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1,266	3,828	897
8	Equity Share Capital (Face Value of the share - Rs. 10/- each)	98,072	98,072	75,072
9	Other Equity		(19,259)	
10	Earnings Per Share (EPS) (after Extraordinary items) of Rs. 10/- each (Not annualised)			
	(A) For Continuing Operations			
	a) Basic	0.07	0.41	0.10
	b) Diluted	0.07	0.41	0.10
	(B) For Discontinued Operations			
	a) Basic	0.05	-	-
	b) Diluted	0.05	-	-

Place : Chennai Date : August 14, 2024

The above results were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors of the Company at

their respective meetings held on August 14, 2024. The above extract is as per Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as

amended). Also, as required, the specified items of the Standalone financial results of the company are given below.						
(Rs. in Lakhs)						
			Standalone			
O No	Doublandana	Quarter Ended	Year Ended	Quarter Ended		
S.No.	Particulars Particulars	30/06/2024	31/03/2024	30/06/2023		
		Unaudited	Audited	Unaudited		
1	Total Turnover of the company	693	2,162	530		
2	Net Profit/(Loss) for the period (before tax, after exceptional and/or extraordinary items)	16	(569)	(218)		
3	Net Profit/(Loss) for the period after tax, Exceptional and/or Extraordinary Items (before discontinued operations)	16	(569)	(218)		
4	Net Profit/(Loss) for the period after tax from discontinued operations	(3,000)	-			
5	Net Profit/(Loss) for the period after tax from continuing and discontinued operations	(2,984)	(569)	(218)		
6	Total Comprehensive Income/(loss) for the period [comprising profit/(loss) and other comprehensive income for the period (after tax)]	(2.985)	(563)	(223)		

The above is an extract of the detailed format of quarterly financial results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (as amended). The full format of these quarterly financia results is available on the Stock Exchange websites (www.nseindia.com and www.bseindia.com) and on the website of the compan

For and on behalf of the Board of Directors

Place: Vadodara Managing Director & CEO DIN: 01312018 Date: August 14, 2024

ADVANI HOTELS & RESORTS (INDIA) LIMITED (CIN L99999MH1987PLC042891)

Regd. Office: Office No. 18A & 18B, Jolly Maker Chambers II, Nariman Point, Mumbai - 400 021 Email: cs.ho@advanihotels.com Tel No.: 022 22850101

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER **ENDED JUNE 30, 2024** (Figures are in ₹ in Lakhs unless specifie Quarter ended Year ended **Particulars** 30.06.2024 31.03.2024 30.06.2023 31.03.2024 Audited Reviewed Reviewed Reviewed Total Income from Operations (net) 2.205.55 3.256.64 2.332.03 10.542.13 Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or 472.26 1.437.91 621.64 3.349.41 Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or 1.437.91 3,349.41 472.26 621.64 Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or 460.97 2.495.75 361.23 1.059.37 Extraordinary items) 1.064.26 460.55 2.487.55 Total Comprehensive Income / (Loss) for the period (Comprising Profit 359.18 (Loss) for the period (after tax) and Other Comprehensive income / 1.848.77 924.39 Equity Share Capital 1.848.77 1.848.77 Other Equity as shown in the Audited Balance Sheet as at March 31, 2024 5,339.96 Earning Per Share (for continuing operations) (for ₹ 2/- each) (Post Bonus issue) Basic EPS (In ₹) 0.39 1.15 0.50 2.70

Diluted EPS (In ₹)

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Full Format of the Quarterly Financial Results are available on the website of BSE and NSE at www.bseindia.com and www.nseindia.com respectively and also on the Company's website at htpp://www.caravelabeachresortgoa.com



For and on behalf of the Board o Directors of the Compan

2.70

1.15

Sunder G. Advan Chairman & Managing Director DIN:00001365



Mumbai, August 14, 2024

DIAMINES AND CHEMICALS LIMITED

CIN NO: L24110GJ1976PLC002905

Registered Office: Plot No. 13, PCC Area, P.O. Petrochemicals, Dist. Vadodara - 391350. Phone: 0265 - 3534200 Fax: 0265 - 2230218 Email: secretarial@dacl.co.in Website: www.dacl.co.in

POSTAL BALLOT NOTICE

Notice is hereby given that pursuant to the provisions of Section 108, 110, and other applicable provisions of the Companies Act, 2013, as amended (the "Act"), read together with the Companies (Management and Administration) Rules, 2014, as amended (the "Management Rules"), General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 20/2020 dated May 5, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 3/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September 25, 2023, issued by the Ministry of Corporate Affairs, Government of India (hereinafter collectively referred to as the "MCA Circulars"), Secretarial Standard on General Meetings issued by the Institute of Company Secretaries of India ("SS-2") and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force) is seeking the approval of its members for passing Ordinary Resolution through Postal Ballot only by way of remote e-voting process ("e-voting").

Resolutions Nο

Appointment of Mr. Priyam Jhaveri (DIN: 00045038) as a Non-Executive, Independent Director.

Shareholders are hereby informed that:

The Board of Directors of the Company at its meeting held on August 09, 2024, recommended to the shareholders for passing of Ordinary Resolution to approve the aforesaid matters by way of Postal Ballot through e-voting.

In accordance with the MCA Circulars, the Company has completed dispatch on August 14, 2024 of Postal Ballot notice along with the Explanatory Statement, Instruction and manner of e-voting process dated August 09, 2024 ("Postal Ballot Notice") through electronic mode only to all Members whose email IDs are registered with the Company/Depositories and whose names are recorded in the Register of member / List of Beneficial Owners as on August 12, 2024 (Cut-off date).

Members, whose email address is not registered/incorrectly registered with the company / Depositories, will also be able to cast his / her vote as per process defined in "Instructions for e-Voting" mentioned in the Postal Ballot Notice.

Members would be able to cast their votes and convey their assent or dissent to the proposed resolution only through the remote e-voting process. For the purpose of e-voting, the Company has engaged the services of Link Intime India Private Limited. The detailed procedure for e-voting is provided in the Postal Ballot Notice.

The Board of Directors of the Company has appointed Mr. Sandip Sheth (Membership No. 5467) or failing him Mr. Prashant Prajapati (Membership No. 32597) of M/s. Sandip Sheth & Associates, the firm of Company Secretaries in whole time practice, Ahmedabad as Scrutinizer for conducting the voting process through Postal Ballot / e-voting in accordance with the law and in a fair and transparent manner.

Cut-off Date: As Shareholder whose names appear on the register of Members / List of Beneficial Owners as on August 12, 2024 will be considered for e-voting. A person who is not a member as on the Cut-off Date should treat this Postal Ballot Notice for informational purposes only

E-voting: The voting period begins on Monday, August 19, 2024 at 9.00 a.m. (IST) and ends on Tuesday, September 17, 2024 at 5.00 p.m. (IST).

In accordance with the MCA / SEBI Circulars, the Company has made necessary arrangements for the members to register their e-mail address. Members who have not registered their e-mail address are requested to register the same (i) with the Depository Participant(s) where they maintain their demat accounts, if the shares are held in electronic form, and (ii) by sending KYC Documents at our Company's Registrar and Share Transfer Agent, M/s. Link Intime India Private Limited, "Geetakunj" 1, Bhakti Nagar Society, Behind ABS Tower, Old Padra Road, Vadodara- 390015 Tel.: (0265) 3566768, Email: vadodara@linkintime.co.in, if the shares are held in physical form.

The Postal Ballot notice is also available on the website of the Company www.dacl.co.in and also available on the website of Link Intime India Private Limited at https://instavote.linkintime.co.in.

In case the shareholders have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to enotices@linkintime.co.in or Call us :- Tel: 022 - 49186000. Members may also write to the Company Secretary of the Company at secretarial@dacl.co.in or at the Registered Office of the Company.

By Order of the Board For Diamines And Chemicals Limited Hemaxi Pawar **Company Secretary** Membership No. A52581

ઓછો દેખાવ કર્યો છે. જો કે, ડેટા** સૂચવે

છે કે જ્યારે ત્રણ વર્ષનો ઐતિહાસિક

આલ્ફા નેગેટિવ હોય છે, ત્યારે નિફ્ટી

ફોરવર્ડ આલ્ફા પોઝિટિવ હોય છે, જે

પોર્ટફોલિયો ગુણવત્તાના સંદર્ભમાં, નિફ્ટી ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ

૫૦ શેરોના નફામાં શ૪૯% યોગદાન

ડીએસપી નિફ્ટી ટોપ ૧૦ ઇક્વલ

વેઇટ ઇન્ડેક્સ ફંડ અને ડીએસપી નિફ્ટી

ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇટીએફ માટેની

નવી કંડ ઓફર ૧૬મી ઑગસ્ટ, ૨૦૨૪

ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને

ટર્નઅરાઉન્ડની સંભાવના દર્શાવે છે.

જે મંદી દરમિયાન ડ્રો-ડાઉન ઘટાડવામાં ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ માટેનો

ું આવલ થલાણાએ જણાવ્યું. નિક્ટી ૫૦૦ ઇન્ડેક્સ કરતાં ૧.૫ ગણું નિક્ટી ટોપ ૧૦ ઇક્વલ વેઈટ વધુ ઈક્વિટી રિટર્ન ધરાવે છે* નાણાકીય ઈન્ડેક્સે નિક્ટી ૫૦ ઈન્ડેક્સ અને નિક્ટી વર્ષ ૨૦૨૪ના રેટાના આપ્રે

જુદા જુદા સમયગાળામાં રોલિંગ બેસિસ િનફ્ટી ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સના

કે કુલ માર્કેટ કેપિટલાઇઝેશનની % અત્યાર ૩૦મી ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બંધ

ઘટકો દ્વારા મળે છે.

કોટક પ્રાર્થવેટ દ્વારા મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ઉત્કૃષ્ટતાનાં ૨૦ વર્ષની ઉજવણી

કેમ્પેઈન ઈનોવેશન અને બીસ્પોક સેવાઓ પ્રત્યે કટિબદ્ધતાની ઉજવણી કરે છે

લિમિટેડ (×કેએમબીએલ" અથવા ×કોટક")નો વિભાગ કોટક પ્રાઈવેટ બેક્રિંગ દ્વારા તેની સૌપ્રથમ મલ્ટીમિડિયા કેમ્પેઈન સાથે ભારતીય ખાનગી બેક્રિંગ ઉદ્યોગમાં ઉત્કૃ ષ્ટતાના બે દાયકાની ગૌરવભેર ઉજવર્ણો કરે છે. આ માઈલસ્ટોન ભારતની અગ્રણી ખાનગી બેકિંગ કંપનીમાંથી એક તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે. કેમ્પેઈમાં પ્રિંટ એડ્સ, આઉટ-ઓફ-હોમ (ઓઓએચ) ડિસ્પ્લેઝ અને ડિજિટલ મંચોનો સમાવેશ થાય છે, જે કોટકનાં વિશ્વસનીયતામાં રોકાણ અને દેશની સૌથી ધનાઢ્ય નાગરિકોના ૫૮% સહિત ભારતના અમુક સૌથી સમૃદ્ધ પરિવારો પર તેના પ્રભાવની ઉજવણી કરે છે.કોટક પ્રાઈવેટ યુએચએનઆઈ (અલ્ટ્રા હાઈ નેટ વર્થ ઈન્ડિવિજયુઅલ્સ) અને એચએનઆઈ (હાઈ નેટ વર્થ ઈન્ડિવિજયુલ્સ)ના ગ્રાહકોને તેમની સંપત્તિનું વ્યવસ્થાપન કરવામાં સહાય કરવા સાથે મૂળભૂત રોકાણ ક્ષિતિજોની પાર જાય છે અને તેમને તેમના હેતુઓને જીવવા માટે અભિમુખ બનાવે છે. સૂઝબૂઝપૂર્વક ઘડવામાં આવેલી મલ્ટીમિડિયા કેમ્પેઈનમાં આકર્ષક જાહેરાતોનો સમાવેશ થાય છે, જે

સમાધાન અને બીસ્પોક સેવાઓ દર્શાવે છે. પેઢીઓને પહોંચી વળે છે. તેની ઓફરોમાં અત્યાધુનિક, નવા યુગના સમાધાન સાથે કોટક પ્રાઈવેટ નાવીન્યપૂર્ણ રોકાણ તકો સાથે પ્રતિકાત્મક બની ચૂકી છે.કેમ્પેઈન લોન્ચ કરતાં કોટક મહિંદ્રા બેક્રના કોટક પ્રાઈવેટ બેક્રા સીઈઓ ઓઈશર્ય દાસે જણાવ્યું હતું કે, ''અમને અત્યાધુનિક રોકાણ સમાધાનો સાથે અમારા ગ્રાહકોને સેવા આપવાના બે દાયકાની ઉજવણી કરવાની ખુશી છે. અગ્રણી ખાનગી બેક્રિંગ કંપની તરીકે અમે અમારા વિવિધ ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળ્યા છીએ. અમારી નવી મલ્ટીમિડિયા કેમ્પેઈન અમારા ગ્રાહકોને સલામી આપે છે, જેઓ અમારા પ્રવાસનો આંતરિક ભાગ હોઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત ખાનગી બેક્ર તરીકે અમારું સ્થાન જાળવી રાખવામાં અમને મદદ કરે છે.''અગ્રણી ખાનગી બેક્રિંગ સંસ્થા તરીકે કોટક પ્રાઈવેટ નાગરિકોને તેમની સંપત્તિ, વૃ દ્ધિ અને સંવર્ધનની જરૂરતોનું નિષ્ણાતો થકી વ્યવસ્થાપન કરવા સાતે જીવનના વધુ નોંધપાત્ર પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સશક્ત બનાવે છે. ભારતીય નિવાસી અને અનિવાસી સહિત એન્ટરપ્રેન્યોર, વેપારી પરિવારો અને વ્યાવસાયિકો સહિત ભારતના અડધોઅડધ પ્રતિષ્ઠિત પરિવારોને કોટક પ્રાઈવેટ દ્વારા ઓફર કરાતા વ્યાપક સેવા આપતાં કોટક પ્રાઈવેટ વિવિધ સ્થાનને વધુ મેજબૂત બનાવે છે."

આરઈઆઈટી (રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) ઈ અને ઈન્વિટ્સઈ (ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) જેવી રોકાણ યોજનાઓ વિશિષ્ટ બેર્કિંગે ર્સમાધાન અને એસ્ટેટ પ્લાનિંગઈ તથા ફેમિલી ઓફિસઇં મેનેજમેન્ટ જેવી અવ્વલ સેવાઓનો સમાવેશ થાય છે.આ કેમ્પેઈન પર બોલતાં કોટક મહિંદ્રા બેકના રિટેઈલ લાયેબિલિટીઝ પ્રોડક્ટના હેડ અને ચીફ માર્કેટિંગ ઓફિસર રોહિત ભસીને ઉમેર્યું હતું કે, "અમારી મલ્ટીમિડિયા કેમ્પેઈન્ ઉદ્યોગના પ્રવાહોમાં આગળ રહેવા માટે અમારો નાવીન્યપૂર્ણ અભિગમ અને મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. અમારા લક્ષ્યના ગ્રાહકો સુધી પહોંચવાની વાત આવે ત્યારે અમે તેઓ સક્રિય રીતે સહભાગી હોય તે પ્રીમિયમ મંચો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જે અમારી કેમ્પેઈન ટોચના યુએચએનઆઈ અને એચએનઆઈ પરિવારો સાથે અસરકારક રીતે સુમેળ સાધે તેની ખાતરી રાખે છે. આ વિશિષ્ટ ચેનલો પ્રત્યે અમારો અભિગમ તૈયાર કરીને અમે અમારી બીસ્પોક ઓફરો પ્રદર્શિત કરવાનું અને અમારા રોકાણ નિષ્ણાતો પર ભાર આપવાનું લક્ષ્ય રાખ્યું છે, જે પ્રાઈવેટ બેક્રિંગમાં ઉત્કૃષ્ટતાની પ્રદાતા તરીકે અમારા



સંખેડા. લાછરસ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ૧૪ ૮ ૨૦૨૪ ના રોજ ભારત સરકારના પરિપત્ર મુજબ હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે એક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે રીતે લાછેરસ પ્રાથમિક શાળાથી મોટા ફળિયા બજાર ફળિયુ વિસ્તાર સુધી જઈને પ્રાથમિક શાળા સુધી પહોંચી હતી જેમાં વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો ગામના આગેવાન શ્રીઓ એ હાજરી આપી તિરંગા યાત્રા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

હ્રદમું સ્વાતંત્ર્ય પર્વ રાજ્યકક્ષાની ઉજવણી આજે નડિયાદમાં થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ ્રપહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી



ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી

રાષ્ટ્રધ્વજ લહેરાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે. આજરોજ સ્વતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા નડીયાદ પહોચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મૂલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી.ત્યારબાદ મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખદિનશા પટેલ અને ટ્રસ્ટીઓએ મુખ્ય મંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા. મુખ્યમંત્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃ તિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. તેમણે ભવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું.સાથે સાથે હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે

વિચાર વિમર્શ કર્યો હતો.આશ્રમના સૌથી

નાના બાળક દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બાળકનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું.દરમિયાન માનવ સેવા એજ પ્રભુ સેવા ની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનક ના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી.મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજે મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાન સુધી દોરી ગયા હતા અને સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી. અહીં નોધવું ઘટે કે, ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિંમિત્તે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા ખાતે ધ્વજવંદન કરાવશે. જ્યારે રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઈ સુરત, ઋષિકેશ પટેલ મહેસાણા, રાઘવજી પટેલ જૂનાગઢ, બલવંતસિંહ રાજપૂત કચ્છ, કુંવરજી બાવળીયા અમરેલી, મુળુભાઈ બેરા બોટાદ, કુબેર ડિંડોર સાબરકાંઠા, ભાનુબહેન બાબરિયા ગીર સોમનાથ, નાયબઅધ્યક્ષ-વિધાનસભા જેઠા આહીર (ભરવાડ) પંચમહાલમાં ધ્વજવંદન કરાવશે.

રોચલ એનફિલ્ડ દ્વારા વિશિષ્ટ ગુજરાત પ્રેરિત ટી-શર્ટ કલેકશન સાથે ગુજરાતના "બહુ ક્લાસિક છે જોશ''ની ઉજવણી

રમોલ અને મિડ-કેપ્સમાં ઊંચા મૂલ્યાંકન વચ્ચે, ડીએસપી મ્યુરયુઅલ ફંડ હારા નિફરી ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ પર આધારિત ભારતનું પ્રથમ ફંડ લોન્ચ

નિફ્ટીના ટોપ ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સએ ૧૬ વર્ષમાંથી

૯ વર્ષીમાં વ્યાપક બજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે

ડીએસપી મ્યુચ્યુઅલ ફંડે ભારતનું ઇક્વલ વેઇટ સ્ટ્રેટેજીમાં, સૌથી મોટા દસ ૧૦ શેરોએ પણ છેલ્લાં ૪ વર્ષમાં અન્ય

પ્રથમ નિફ્ટી ટોર્પ ૧૦ ઇક્વલ વેઇટ સ્ટોક હશે. નિફ્ટી ટોપ ૧૦ ઇક્વલ વેઇટ વ્યાપક ઇન્ડેક્સ/સક્રિય ફંડ્સની તુલનામાં ઇન્ડેક્સ લાંબા ગાળાના પોર્ટફોલિયોનો

ભાગ બની શકે છે કારણ કે તે સૌથી મોટી

કંપનીઓને એક્સપોઝર પ્રદાન કરે છે

મદદ કરી શકે છે અને લાંબા ગાળે વધુ

સારું વળતર પણ જનરેટ કરી શકે છે,×

ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના પેસિવ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ પ્રોડક્ટ્સ સીએફએ,

૫૦૦ ઈન્ડેક્સને લાંબા ગાળાના તેમજ

કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. નિફ્ટીના

ટોચના ૧૦ ઇક્વલ વેઇટ ઇન્ડેક્સએ

૧૬ માંથી ૯ વર્ષમાં વ્યાપક બજારને

પાછળ રાખી દીધું છે∗. હાલમાં, ટોચની

૧૦ કંપનીઓ ટોચના ૧૦ સ્ટોકના વેઇટ

તરીકે સારી રીતે મૂકવામાં આવી છે કારણ

સુધીના સૌથી નીચા સ્તરે છે. ટોચના થશે.

ભટકવાની લાલસા અને મૈત્રીને સમકાલીન રીતે આલેખિત કરતી રોયલ એનફિલ્ડે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ખૂબી પ્રાદેશિક ટી-શર્ટ કલેકશન ગર્વપૂર્વક રજૂ કરીને સલામી આપી છે. મોટરસાઈકલિંગ માટે વૈવિધ્યતા અને સમાન જોશની ઉજવણીમાં રોયલ એનફિલ્ડ ૧૬ વિશિષ્ટ ડિઝાઈન લાવી છે, જે દરેક અલગ અલગ ભારતીય રાજ્યોનો અજોડ વારસો, સંસ્કૃતિ અને જોશને સલામી આપે છે. દરેક ડિઝાઈનમાં પ્રદેશની ખૂબી છે, જે તેમનાં મૂળ સાથે વળગી રહેતા રાઈડરો

ઇન્ડેક્સ ફંડ અને ઇટીએફ લોન્ચ કર્યું

છે, જે ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન

દ્વારા નિફ્ટીમાં ટોચની ૧૦ ભારતીય

કંપનીઓમાં સમાન રીતે રોકાણ કરે છે.

ડીએસપી નિફ્ટી ટોપ ૧૦ ઇક્વલ વેઇટ

ઇન્ડેક્સ ફંડ અને ડીએસપી નિફ્ટી ટોપ

૧૦ ઇક્વલ વેઇટ ઇટીએફ નો હેતુ નિફ્ટી

૫૦ અને નિફ્ટી ૫૦૦ ની સરખામણીમાં

ટોચના ૧૦ શેરોના પ્રમાણમાં વધુ સારા મૂલ્યાંકન જેવા કે P/E રેશિયો, રિટર્ન ઓન

ઇક્વિટી અને રિટર્ન ઓન એસેટ રેશિયો

"જ્યારે આપણે નાના અને મિડ-કેપ

શેરોમાં રુચિનું સ્તર વધતું જોયું છે, ત્યારે વેરી લાર્જ અને મેગા કેપ શેરો પ્રમાણમાં

વધુ આકર્ષક વેલ્યુએશન પર ટ્રેડ થતા દેખાય છે. સારા રોકાણના સિદ્ધાંતો સૂચવે

છે કે જ્યાં પ્રમાણમાં નીચું મૂલ્યાંકન અને

સલામતીનું માર્જિન હોય ત્યાં રોકાણ કરવું

હંમેશા વધુ સારું છે. તેથી, અમે એવા ઇન્ડેક્સને ધ્યાને લઈ રહ્યા છીએ કે જેમાં

પર આધારિત છે.

સ્મારકોથી પ્રસિદ્ધ સીમાચિહનો સુધી દરેક ટી-શર્ટ તેના સંબંધિત પ્રદેશની અજોડ ખૂબી સૂઝબૂઝપૂર્વક આઈકોનિક બુલેટ/ ક્લાસિકનું નિર્વિવાદ સિલ્હટ શોભે છે. ગુજરાતના રાઈડરો ×બહુ સરસ છે" ટી-શર્ટ સાથે તેમની આઈકોનિક મોટરસાઈકલો માટે તેમના સ્થાનિક ગૌરવ અને પ્રેમને પ્રદર્શિત પ્રેરિત કરે છે.

સાથે સુમેળ સાધે છે. સૂઝબૂઝભરી બારીકાઈ કરી શકે છે. આ શર્ટ વસ્ત્રોથી પાર જાય છે. તે સાથે ઘડવામાં આવેલાં રોજ્ય પ્રેરિત ટી- રાજ્યના અજોડ જોશ, તેની બોલીભાષા અને શર્ટસ સ્થાનિક ગૌરવનું દ્યોતક છે. અદભુત રાઈડરની વિશ્વસનીય રોયલ એનફિલ્ડની ઉજવણી છે.રૂ. ૯૯૦ની કિંમત સાથે આ ટી-શર્ટસ ૧૦૦ ટકા બીસીઆઈ કોટન સાથે આલેખિત કરે છે, જેમાં દરેક ડિઝાઈનેમાં તૈયાર કરાયાં છે, જે કમ્ફર્ટ અને સ્ટાઈલને સમાન કરવાનું વચન આપે છે. ખુલ્લા રસ્તાઓથી રોજબરોજની સાહસો સુધી આસાનીથી સુમેળ સાધતાં આ ટી-શર્ટસ કોઈ પણ રાઈડરને વોર્ડરોબમાં અવશ્યક ઉમેરવા

સાવલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ખાતાકીય બદલી થતાં આજરોજ તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો

આજરોજ સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિકાસભાઈ પ્રજાપતિ ની ખાતાકીય ખાતાકીય બદલી થવા પામી છે તેના કારણે આજરોજ સૌ જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના

સદસ્ય તાલુકા તલાટી સંઘ તાલુકા પંચાયતનો સ્ટાફ સૌ સરપંચો દ્વારા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો અને આ પ્રસંગે તેમનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે બુકે પણ પ્રજાકીય પ્રશ્નોને ઉકેલવાની કુનેહ અને



અર્પણ કરવામાં આવ્યા હતા આ કરવાની તેમની આગવી રીતે આવી હતી રબારી તાલુકો સંઘના પ્રમુખ યોગેશ પટેલ વેળાએ હાજર જનોએ તાલુકા વિકાસ અને સૌ તાલુકા પંચાયતના સ્ટાફનો તેમની સહિતના અંગ્રણીઓ અને સરપંચો સહિત અધિકારી ના ફરજ દરમિયાન તેઓએ વિદાય વેળાએ આંખોના ખૂણા ભીના મોટી સંખ્યામાં પદાધિકારીઓ હાજર રહ્યા થઈ ગયા હતા આ પ્રસંગે જિલ્લા શિક્ષક 🛮 હતા આ સમયે વિદાય લઇ રહેલા તાલુકા અધિકારી તેમજ કર્મચારીઓ અને સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારીએ ભારે ગદગદિત થઈને પદાધિકારીઓ સાથે સુમેળ ભર્યો તલાટી સંઘના પ્રમુખ જીગ્નેશ પટેલ તાલુકા સૌ કોઈ નો આભાર વ્યક્ત કર્યો હતો.

મહત્વાકાંક્ષાઓની માવજત સાથે શ્રેષ્ઠતાની ઉજવણી!

२०२४-२५नी रिसायन्स इ। उन्डेशननी ५१०० સ્કોલરશીપ માટે અરજીઓ કરવાનો પ્રારંભ

રિલાયન્સ ફાઉન્ડેશને ભારતભરમાંથી ૫,૧૦૦ તેજસ્વી અંડરગ્રેજ્યુએટ અને અને ઉદાર નાણાકીય અનુદાન થકી, આ સાકાર કરવા અને ભારતના ભાવિ પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને શોધી કાઢવા, તેમને મદદરૂપ થવા અને અને વ્યાવસાયિક આકાંક્ષાઓ પરિપૂર્ણ આપવાની તેમની ક્ષમતાને બહાર માર્ગદર્શન આપવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪- કરવામાં મદદરૂપ થાય છે. ફર્સ્ટ-પેર લાવવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે ૨૫ માટે તેના પ્રતિષ્ઠિત સ્કોલરશીપ અન્ડરગ્રેજ્યુએટ તેમજ ભારતભરની છે. આ સ્કોલરશીપ મેરિટ-કમ-મીન્સ પ્રોગ્રામ હેઠળ અરજીઓ મેળવવાની સંસ્થાઓમાંથી ફુલ-ટાઈમ રેગ્યુલર ડિગ્રી મુજબ ૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને જાહેરાત કરી છે.રિલાયન્સ ફાઉન્ડેશન કોર્સમાં અભ્યાસ કરી રહેલા અનુસ્નાતક તેમના અંડરગ્રેજ્યુએટ કૉલેજ શિક્ષણ સ્કોલરશીપનો ઉદ્દેશ ઉત્કૃષ્ટતાની વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.રિલાયન્સ માટે એનાયત કરાશે, જેથી તેઓ આર્થિક

વિકાસગાથાની આગેવાની લેવા માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળ

સશક્ત બનાવવાનો છે. સાર્વત્રિક મદદ વ્યાવસાયિક બનવાના તેમના સપનાંને સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન માવજત કરીને યુવાનોને ભારતની ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ બોજા વિના અભ્યાસ ચાલુ રાખી શકે.

ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી

વાણિજ્ય મંત્રી તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ મંત્રી ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર પેટ્રિક રાતાનાં નેતૃત્વમાં ૯ સભ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે કૃ ષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશોના લોકોમાં પરસ્પર લાંબાગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી

• અમદાવાદ, તા. ૧૪

ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને

ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે બેઠકો અને વર્કશોપ યોજાય તેવી ઈચ્છા લાભદાયી એવા 'ખેડૂત વિનીમય કાર્યક્રમ પણ ડેલીગેશન સમક્ષ વ્યક્ત કરી હતી. (ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ)' શરૂ કરવા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પર ભાર મૂક્યો હતો.ન્યૂઝીલેન્ડ ડેરી ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રણી ટેકનોલૉજીમાં અગ્રણી દેશ છે. ડેરી રાજ્ય છે. એટલું જ નહિ, રિન્યુએબલ વિકાસમાં આ ટેકનોલૉજીનો લાભ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક ગુજરાતને પણ મળે તે માટે મુખ્યમંત્રીએ વાહનોના ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં પણ કૃષિ, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને ગુજરાત અગ્રેસર છે અને આ બધા હતી.મુખ્યમંત્રીએ ગુજરાતમાં ગાય સહકારી ક્ષેત્રોમાં સહેયોગ અંગે ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડ સાથે સહયોગ કરવા આધારિત ખેતીથી ખેડૂતોની આવક ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગ્રામીણ ઉત્સુક છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ બમણી કરવા માટેનું તેમનું વિઝન વિસ્તારોમાં મહિલાઓની નવીનતમ ન્યુઝીલેન્ડમાં વસતા મહેનતું ગુજરાતી શેર કર્યું હતું. વધુમાં, ગુજરાત અને વિચારસરણીને પોષવા માટે સમયાંતરે સમુદાય અંગે પણ ચર્ચા કરી હતી.

રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ નાગરિકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓની આપ-લે કરી

નડિયાદમાં ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'એટ હૉમ' સમારોહ દરમ્યાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓની આપ-લે કરી હતી. નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત 'એટ હૉમ' કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પોલીસ બેન્ડના ડ્રમ રોલની સુરાવલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પોલીસ વડા વિકાસ સહાયે તેમને આવકાર્યા હતા. બાદમાં રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. એસ. એન.વી ઇન્ટરનેશનલ શાળાના વિધાર્થીઓએ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી. રાજ્યપાલ અને મુખ્યમંત્રી અરેરાના ૧૦૨ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની કેસરીસિંહ પરમારને તેમની પાસે જઈ મળ્યા હતા અને ક્ષેમકુશળ પૂછ્યા હતા.આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું કરીશું તો જ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દેશને એક કરનાર સરદાર વલ્લભભાઈ



કે,અનેક યોદ્ધાઓના લોહીની આહુતિ બાદ મહામૂલી આઝાદી મળી છે, ત્યારે ભવિષ્યની પેઢીને તેને ઉત્તમ રીતે જાળવીને આપવાની જવાબદારી આપણા સૌની છે. આપણે આપણા કર્તવ્યોનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન બનશે. પ્રત્યેક ક્ષણ આપણે જે જવાબદારી સંભાળી રહ્યા છીએ તેને ઈમાનદારીથી પૂર્ણ

'વિકસિત ભારત'ના લક્ષ્યને સિદ્ધ કરી શકીશું. નડિયાદની બળુકી ધરાના મહાત્મ્યનું વર્શન કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા જિલ્લા સહિત સમગ્ર ચરોતર અગ્રદૂત હતો. આ ભૂમિએ સાક્ષરો, સંતો અને સ્વાતંત્ર વીરોની મહામૂલી ભેટ દેશને આપી છે. સમગ્ર

પાટેલની જન્મભૂમિ છે.

CIN NO: L24110GJ1976PLC002905

૨જીસ્ટર્ડ ઓફિસ: પ્લોટ નં. ૧૩, પીસીસી એરિયા, પી.ઓ. પેટ્રોકેમિકલ્સ, વડોદરા - ૩૯૧૩૫૦. ફોન: ૦૨૬૫-૩૫૩૪૨૦૦ ફેક્ષ: ૦૨૬૫-૨૨૩૦૨૧૮ ઇ-મેલ: secretarial@dacl.co.in વેબસાઇટ: www.dacl.co.in

પોસ્ટલ બેલેટ નોટિસ

આથી સૂચના આપવામાં આવે છે કે, કલમ-૧૦૮, ૧૧૦ અને કંપની એકટ-૨૦૧૩ ની અન્ય લાગુ જોગવાઈઓને અનુસંધાનમાં, જેમ કે સુધારેલ (**" અધિનિયમ"**), કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડિમેનિસ્ટ્રેશન) નિયમો-૨૦૧૪ સુધારેલ (" વ્યવસ્થાપન નિયમો "), સામાન્ય પરિપત્ર નંબર : ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, !૦૨૦, ૧૭/૨૦૨૦, તારીખ ૧૩ આપ્રલ, ૨૦૨૦, ૨૦/૨૦૨૦, તારીખ ૫ મ. ૨૦૨૦, ૨૨/૨૦૨૦, તારીખ ૧૫ જુન, ૨૦૨૦, ૩૩/૨૦૨૦ તારીખ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦, ૩૯/૨૦૨૦, તારીખ ૩૧ કિસેમ્બર, ૨૦૨૦, ૧૦ $rack{race{7}}$ ૨૦૨૧, તારીખ ૨૩ જુન, ૨૦૨૧, ૨૦ $race{7}$ ૨૦૨૧, તારીખ ૮ કિસેમ્બર, ૨૦૨૧, ૩ $race{7}$ ૨૦૨૨ તારીખ ૫ મે, ૨૦૨૨, ૧૧/૨૦૨૨, તારીખ ૨૮ કિસેમ્બર, ૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવે છે (ત્યારબાદ સામૂહિક રીતે "MCA પરિપત્રો"તરીકે ઓળખવામાં આવે છે), ઈન્સ્ટીટચુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાચેલ સામાન્ય સભાઓ પર સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ ("**SS-2**") અને કોઈપણ અન્ય લાગુ કાયદા, નિયમો અને વિનિયમો (કોઈપણ વૈદ્યાનિક ફેરફાર(ઓ) અથવા તેના પુન:અદિનિયમ(ઓ) સહિત જયારે જે તે સમય માટે અમલમાં હોંચ તેવા) કંપનીના સામન્ય દરાવ દ્વારા, માત્ર રિમોટ ઈ-વોટીંગ પ્રક્રિયા ("ઈ-વોટીંગ ") દ્વારા તેના સભ્યોની મંજુરી માંગી રહી છે.

અનુ. ઠકાવ

સ્થળ : વડોદરા

તારીખઃ ઓગષ્ટ ૧૪, ૨૦૨૪

શ્રી પ્રિયમ ઝવેરી (DIN: 00045038) ની બિન-કાર્યકારી, સ્વતંત્ર ડિરેકટર તરીકે નિયુક્તિ.

આથી શેરદ્યારકોને જણાવવામાં આવે છે કે :

૧. કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સે ૦૯ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ ચોજાચેલી તેની મીટીંગમાં શેરધારકોને ઈ-વોટીંગ દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા ઉપરોક્ત બાબતોને મંજુર કરવા માટે સામન્ય ઠરાવ પસાર કરવાની ભલામણ કરી

ર. એમ.સી.એ. ના પરિપત્રો અનુસાર, કંપનીએ ૧૪ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ પોસ્ટલ બેલેટ નોટિસ (તારીખ ૦૯ ઓગષ્ટ, ૨૦૨૪) મોકલવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં સ્પષ્ટ નિવેદન સૂચના અને ઈ-વોટીંગ પ્રક્રિયાની રીત સાથે, માત્ર ઈલેકટ્રોનિક મોડ હ્યારા એવા તમામ સભ્યો માટે કે જેમના ઈ-મેલ આઈ.ડી. કંપની / કિપોઝીટરીઝમાં નોંધાચેલા છે અને જેમના નામ ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪ (કટ-ઓફ તારીખ) ના રોજ સભ્ય / લાભદાચી માલિકોની યાદીમાં નોંધાયેલા છે.

સભ્યો, જેમનું ઈ-મેઈલ સરનામું કંપની / ડિપોઝીટરીઝમાં નોંધાયેલ / ખોટી રીતે નોંધાયેલ નથી, તેઓ પણ પોસ્ટલ બેલેટ નોટીસમાં ઉલ્લેખીત ઈ-વોટીંગ માટેની સૂચનાઓમાં વ્યાખ્યાચિત પ્રક્રિયા અનુસાર પોતાનો

સભ્યો તેમના મત આપી શકશે અને સૂચિત ઠરાવ પર તેમની સંમતિ અથવા અસંમતિ ફકત દૂરસ્થ ઈ-વોટીંગ પ્રક્રિયા દ્વારા જ વ્યક્ત કરી શકશે. ઈ-વોટીંગના हેતુમાટે, કંપનીએ લીંક ઈનટાઈમ ઈન્ડીયા પ્રાઈવેટ લીમીટેડની સેવાઓ રોકી છે. ઈ-વોટીંગ માટેની વિગતવાર પ્રક્રિયા પોસ્ટલ બેલેટ નોટીસમાં આપવામાં

કંપનીના બોર્ડ ઓફ ડિરેકટર્સે શ્રી સંદિપ શેઠ (મેમ્બરશીપ નં.૫૪૬૭) અથવા તેમની અવેજીમાં (ગેરહાજરીમાં) શ્રી પ્રશાંત પ્રજાપતિ (મેમ્બરશીપ નં.૩૨૫૯૭) મે. સંદિપ શેઠ એન્ડ એસોસીએટસ, સમગ્ર સમયની પ્રેકટીસમાં કંપની સેક્રેટરીઓની પેઢી, અમદાવાદ, કાયદા અનુસાર અને ન્યાચી અને પારદર્શક રીતે પોસ્ટલ બેલેટ / ઈ-વોટીંગ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવા માટે સ્કૂટિનાઈઝર તરીકેની નિમણુંક કરી છે. **૬. ક્ટ-ઓફ તારીખ**ઃ શેરધારક તરીકે જેમના નામ સભ્યોના રજસ્ટરમાં / લાભદાચી માલિકોની ચાદીમાં

૧૨ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ દેખાય છે તે ઈ-વોટીંગ માટે ધ્યાનમાં લેવામાં આવશે. જે વ્યક્તિ કટ ઓફ તારીખે સભ્ય નથી તેણે આ પોસ્ટલ બેલેટ નોટીસનો ઉપયોગ માત્ર માહિતીના હેતુ માટે કરવો જોઈએ. છ. **ઈ-વોટીંગ** : મતદાનનો સમયગાળો **સોમવાર, ૧૯ ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૦૦ વાગ્યે** (IST) શ**રૂ**

થાય છે અને મંગળવાર, ૧७ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્ચે (IST) સમાપ્ત થાય છે. MCA/SEBI ના પરિપત્રો અનુસાર કંપનીએ સભ્યો માટે તેમના ઈ-મેલ સરનામાની નોંધણી કરાવવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે. જે સભ્યોએ તેમનું ઈ-મેલ સરનામું રજીસ્ટર કરાવ્યું નથી તેઓને વિનંતી કરવામાં આવેછે કે તેઓ

(i) ડીપોઝીટરી પાર્ટિસિપન્ટ(ઓ) સાથે જયાં તેઓ તેમના ડીમેટ ખાતાઓ જાળવી રાખે છે. જો શેર ઇલેકટ્રોનિક સ્વરુપમાં રાખવામાં આવ્યા હોય અને (ii) જો શેર ભૌતિક સ્વરુપમાં રાખવામાં આવ્યા હોય તો કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટાન્સફર એજન્ટ મે. લીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ગીતાકુંજ ૧, ભક્તિનગર સોસાયટી, ABS ટાવર પાછળ, જુના પાદરા રોક, વકોદરા - ૩૯૦૦૧૫. ટેલીફોન : (૦૨૬૫) ૩૫૬૬૭૬૮, E-mail vadodara@linkintime.co.in ઉપર તેમના KYC ડોક્યુમેન્ટસ મોકલીને ૨જીસ્ટર કરી શકે છે / સુધારાવી શકે છે. પોસ્ટલ બેલેટ નોટીસ કંપનીની વેબસાઈટ <u>www.dacl.co.in</u> પર પણ ઉપલબ્ધ છે અને લિંક ઈનટાઈમ ઈન્ડિીયા પ્રા. લી. ની વેબસાઈટ <u>https://instavote.linkintime.co.in</u> પર પણ ઉપલબ્ધ છે.

જો શેરધારકોને ઈ-વોટીંગ અંગે કોઈ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તેઓ મદદ વિભાગ હેઠળ અથવા https://instavote.linkintime.co.in પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ("FAQs") અને Instavote ઈ-વોટીંગ મેન્યુઅલનો સંદર્ભ લઈ શકે છે, <u>enotices@linkintime.co.in</u> પર ઈ-મેલ કરી શકે છે અથવા ટેલિફોન : ૦૨૨-૪૯૧૮૬૦૦૦ પર કૉલ કરી શકે છે. કંપનીના સભ્યો કંપની સેક્રેટરીને <u>secretarial@dacl.co.in</u> પર અથવા કંપનીની રજસ્ટર્ડ ઑફિસમાં પણ પત્ર લખી શકે છે.

બોર્ડના હુકમથી, ડાયામાઈન્સ એન્ડ કેમીકલ્સ લિમિટેડ વતી, હેમાસી પવાર કંપની સેક્રેટરી મેમ્બરશીપ નં. Aપરપ૮૧

M. P. AGRO INDUSTRIES LIMITED Reg. Office Add: 924, 9th Floor Fortune Tower, Sayajigunj, Vadodara - 390005

ebsite: www.mpagroindustries.in, Email: mpagroindustries@gmail.com, Phone No. 0265 - 23152583, CIN:L24123GJ1975SGC106981

EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT (STANDALONE) FOR THE OHARTER ENDED HINE 30, 2024

	THE GOANTER ENDED JOINE 30, 2024 (Hs. Lakhs)							
Sr. No.	Particulars	Quarter Ending 06.2024	Year to Date 04.2024 to 06.2024	Corresponding 3 Months Ended in previous year 06.2023				
1	Total Income from operations	0.00	0.00	0.00				
2	Other Income	10.09	10.09	8.17				
3	Net profit (loss) for the period	2.57	2.57	2.83				
4	Net Profit Loss for the period before Tax	2.57	2.57	2.83				
5	Net Profit Loss for the period after Tax	1.90	1.90	2.09	H			
6	Total Comprehensive Income for the period	0.00	0.00	0.00				
7	Equity Share Capital	580.39	580.39	580.39				
8	Reserves excluding revaluation reserve as shown in the Audited Balance Sheet of the previous year							
9	Earnings Per Share (of ₹10/- each)							
	Basic	0.030	0.030	0.040				
	Diluted	0.030	0.030	0.040				
Note	Note: The above is an extract of the Audited Financial Results filed with the Stock Exchanges under Reg.33 of the SEBI (LODR) Reg.							

2015, the full format are available on the websites; www.bseindia.com & www.mpagroindustries.in By order of the Board

Date: 14th August, 2024

Shamim Sheikh, Chairman



Steelco Guiarat Limited

Registered Office: Plot No.2, G.I.D.C. Estate, National Highway No. 8, Palej - 392 220. Tel No.: 91-2642-277 479 / 480 / 481. Website: www.steelcogujarat.com | CIN No.: L27110GJ1989PLC011748

EXTRACTS OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE **QUARTER ENDED 30TH JUNE 2024.**

			(Rs. in Lakns)
Particulars	Quarter	ended	Year ended
	30.06.2024	30.06.2023	31.03.2024
	(Unaudited)	(Unaudited)	(Audited)
Total Income from operations	30.74	-	30.82
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	(318.16)	143.78	(446.12)
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	(318.16)	143.78	16,540.85
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	(318.16)	143.78	16,540.85
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(318.16)	143.78	16,540.85
Equity Share Capital	49.66	4,256.18	49.66
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year.	_	_	(2,603.04)
Earnings Per Share (Face Value of Rs. 10/- each) (for continuing and discontinued operations)(in Rs.)			
Basic	(64.07)	0.03	333.08
Diluted	(64.07)	0.03	333.08

The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Stock Exchange (BSE) (www.bseindia.com) and on Company's website (www.steelcogujarat.com)

The above Financial Results have been reviewed and recommended by Audit Committee and have been approved by the Board of Directors at their respective meeting held on August 13, 2024. The above Financial Results have also been Limited reviewed

> For and on behalf of Board of Directors of Steelco Gujarat Limited

ANOOP KUMAR SAXENA Date: 13.08.2024 **Managing Director**